

શ્રી અશોપિષાંગ

ગંધારાણી

૧૭૯૬

૩૦૦૧૮૫૬

૧૯૪૪-૨૦૧૦ : મિલિનિયલ
સાલાના, લાલબન્દ.
ગાંધીય, સાસાગર.

બન્દ્રસુરિયન્થમાલા પુસ્તક ૪૨ રૂ.



શ્રીપ્રભોતરપ્રકાશ

દ્વિતીય ભાગ.



કાખ—

મુનિ શ્રીસાગરચંદ્ર

આચાર્ય શ્રી જ્ઞાતૃચન્દ્ર સુરિયન્થ માલા પુસ્તક ૪૨.

॥ શ્રીપાદ્યંદ્રસુરિસદ્ગુરુભ્યો નમો નમઃ ॥

અહીં

શ્રીપ્રભોત્તરપ્રાણ દ્વિતીય ભાગ

લેખક—

પરમપૂજય-પ્રાતઃસ્મરણીય-શાસ્ત્રરસનિમન્થ-
વિદ્વદ્ય-જૈનાચાર્યગુણભૂપિત-શ્રીપ્રાતઃસ્મરણ
સૂરીધરજ સાહેબના શિષ્ય—

મુનિરાજ શ્રીસાગરચંદ્રજ મહારાજ

પ્રકાશઃ—

શા. ગોકુલહાસ મંગલહાસ
લુહારની પોળ-આમદાવાદ.

વિ. સં. ૧૯૮૮ પ્રથમાવૃત્તિ પ્રત ૧૦૦૦ સન ૧૯૩૨.

કી. ડી. પોસ્ટ અર્ચ એકઆનો.

ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસમાં પટેલ મૂળચંદ્રાઈ ત્રિકમલાલે
છાયો. ડૉ. પાનકોર નાકા—આમદાવાદ.



श्रीसरस्वती-श्रुतहेवी स्तुतिः-

अनुष्टुप् श्लोक-अष्टपदी.

१वेतपद्मासना हैवी, २वेतपद्मोपशोऽलिता.
३वेताभ्यरधरा हैवी, ४वेतगन्धानुवेपना;
अर्चिताभुनिलिःसर्वे—ऋचिलिःस्तूयते सदा,
अवं द्यात्वा सदा हैवीं, वाञ्छितं ललते नरः॥१॥

श्री सद्गुर स्तुति.

(मालिनी छ.६.)

उद्यशिअरियंद्राः सद्यचेऽडलोऽधियंद्राः
सुकृतकुमुदयंद्रा ध्वांतविष्वंसयंद्राः
कुमतनलिनयंद्राः कीर्तिविष्यातयंद्राः
प्रमदजननयंद्राः श्रेयसे पार्क्षयंद्राः
श्रेयसे भ्रातृयंद्राः ॥१॥

॥ सद्गुरावृतम् ॥

श्रीमद्विघावतंसाः शमद्भसहिता बालबावाद्विरक्ता,
शानाल्यासे प्रवृत्ता निभिलज्जनभनोङ्खदाःस्वैर्णुणुघैः।
मध्यस्था मान्यवाक्या दलितमहभला भ्रातृयंद्रालिधाना,
स्तात् श्वेतीर्णमोहा नित्रपमरिताः सूरिसाम जयन्तु॥२

પ્રકાશનનું પ્રયોજન.



વિવેકી વાંચક વૃદ્ધને વિદીત થાય જે આ પ્રશ્નોત્તર પ્રકાશ સાગ ર જના પ્રકાશનનું પ્રયોજન એટલુંજ કે વીરશાસન પત્રના તા. ૧૩-૫-૧૬૩૨ ના અંકમાં સુખલાલ ખૂખ્યંદના નામથી ‘શ્રી ‘ સાગરચંદ્રજી નીચેની બાબતોનો ખુલાસો કરશે કે ?’ નામક હેડી-ગથી જહેર રીતે ૨૫ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પુખ્ત વિચારતાં ખુલાસા આપવાની આવશ્યકતા લાગવાથી વીરશાસનના તંત્રી પર નીચે મુજબના પત્ર સાથ સવાલોના ખુલાસા રજુસ્ટર કાગળથી ખીઠી મોકલ્યા હતા.

(પત્રની નકલ)

ઓલ પીપણો,
નૈન ઉપાશ્રય.
ખંભાત તા. ૧૩-૭-૧૬૩૨.

તંત્રી મહાશય,

વીરશાસન.

ધર્મલાલ પૂર્વક લખવાનું જે-તમારા તા. ૧૩-૫-૧૬૩૨ ના વીરશાસનના ૩૩ મા અંકમાં શા. સુખલાલ ખૂખ્યંદે અમોને ‘સાગર-ચંદ્રજી નીચેની બાબતોનો ખુલાસો કરશે કે ?’ નામક હેડીંગથી પૂછેલા પ્રશ્નોના ખુલાસા આપીએ છીએ તે તમારા પત્રમાં સુયોગ સ્થાને જેમ અને તેમ જલ્દીથી હવે પઢીના નીકળતા અંકમાં પ્રસિદ્ધ કરશો.

ન્યારે પ્રશ્નો ન ધૂઢ્યવા જેગ રીતે, અમો પાસે હોવા છતાં જહેર પેપરમાં પૂછવામાં આવ્યા છે ત્યારેજ અમોને આમ જહેર જનતા બ્રમમાં ન રહે તેટલા માટે આ ખુલાસા તમોને મોકલી આપવાની ઝરજ પડી છે.

જે પત્રમાં પ્રશ્નો પૂછાયા હોય તેજ પત્રમાં તેના ખુલાસા આવે કે જેથી તે પત્રના વાંચક વર્ગને સમજવું અનુકૂળ થઈ પડે તેવા આશયથી અમોએ તમારા પર આ ખુલાસા લખી મોકલ્યા છે, તો આશા રાખીએ છીએ કે વિના વિલંબે આ ખુલાસા જેવી રીતે લખાયા છે તેવી રીતે પ્રસિદ્ધ કરશો, કે જેથી લેખકના આશયમાં ફેરફાર ન થઈ જાય. એજ.

તા. ભદ્ર.

લી.

મુનિ સાગરચંદ્ર
સહી દા, 'અમૃત' કાટવાળા.

આ રજુસ્ટર કાગળની પાસ્ટલ પહોંચ પણ ચોંચ મુદ્દતમાં મળી હતી.

કેટલાક એંકો સુધી ગાહ જોઈ પણ તેને માટેનો કંદુ ઉત્તર કે ખુલાસા પ્રગટ ન થવાથી વસ્તુસ્થિતિ ધ્યાન પર લાવવા તંત્રી પર રીતસર નીચે મુજબની રીમાધન્દર લખી-ખીડી હતી.

શ્રીમાઈન્ડર

તંત્રી મહાશય,

વીરશાસન પત્રની એપ્રીસ.

મુ. અમદાવાદ.

ધર્મલાલ પૂર્વક લખવાનું જે-તમોને અમોએ તા. ૧૩-૭-૩૨ ના દિવસે, તમારા પત્રમાં તા. ૧૩-૫-૧૬૩૨ ના વીરશાસનના ૩૩ મા અંકમાં શા. સુખલાલ ખૂખ્યદે અમોને સાગરચંદ્રાની નીચેની બાય્યતોને ખુલાસો કરશો કે ?' નામક હેડીગર્થી પૂછેલા પ્રશ્નોના ખુલાસા લખીને રજુસ્ટર લેટરથી પ્રગટ કરવા સારુ ખીડી મોકલ્યા હતા. જે તમોને મહ્યાની અમોને પહોંચ પણ મળી હતી.

પરંતુ તમારા ત્યાર પણી ત્રણું એંકો બહાર પડી ચૂક્યા, જેમાં મોકલેલી મેટર આવી કે નહિ ?-તે તપાસતાં અમોને આશ્રયચિક-

તतા સાથે જણાવવાની કુરજ પડે છે કે જનહોર રીતે તમારા પત્રમાં શા. સુખલાલ ખૂબચંદ નામક વ્યક્તિના નામથી પૂછાયેલ પ્રશ્નના યોગ્ય ખુલાશા॥ પ્રગટ થવાને માટે મોકલેલા તે ત્રણ અંકો અહાર પડવા છતાં પ્રગટ થયાં નથી કે-સ્થળ સંકોચને અંગે, યા ડોધ એવા પ્રકારના કારણે પ્રસિદ્ધ કરી શક્યાં નથી. જે પત્રમાં પ્રશ્નો પૂછાયા હોય તેજ પત્રમાં ખુલાસા આવે તે યોગ્ય એમ વિચારી અમોદ્યે તે ખુલાસા લખી મોકલ્યા છે અને તેનો સંતોપકારક રીતે તે પત્રના વાંચકોના અંતરમાં ખુલાસો થાય એમ પણ છંચાયું છે એટલે તે ખુલાસા જલ્દી પ્રસિદ્ધ થવાની અનિવાર્ય આવસ્યકતા છે. ઉપરોક્ત વિદીત વસ્તુ સ્થિતિ તમારા ધ્યાન પર લાવવા આ ‘રીમાઈન્ડર’ લખી મોકલવાનો ગ્રયતન થયો છે તે જાણુશો.

વળી આ સાથે ઉચ્ચિત ધારી, તમોને નમ્ર સ્થયના કરવી પડે છે કે-જનહોર પત્રની નીતિ ધ્યાલમાં લેશો અને રજુસ્ટર લેટરથી ખીડી મોકલેલ ખુલાસા જેમ બને તેમ જલ્દીથી તમારા હવે પછીના અંકમા પ્રસિદ્ધ કરશો. આની અનિવાર્ય આવસ્યકતા હોધ, જે યોગ્ય સમયમાં તેને માટે યોગ્ય નહિ થાય તો અમોને જણાવતાં ધર્ષી દીલગીરી થાય છે કે અમારે કુરજાત જહોર જનતા છેક અંધારામાં ના રહે તેને માટે યોગ્ય કરવું પડશે.

આ રીમાઈન્ડર પહેંચ્યાની પહેંચ તેમજ પૂર્વે મેટર પ્રસિદ્ધ કરવા માટેનો ખુલાસો લખશો. એવી આશા રાખી વિરમીએ છીએ. એજ :: અં શાંતિ !

શ્રી પાદ્યસ્થૂરિ જૈન ઉપાશ્રય

લી.

ઓળ્હપીપળો.

ખંભાત તાં. ૨-૮-૧૯૩૨

મુનિ સાગરચંદજીના વર્મલાલ

સહી. દા. ‘અમૃત’ કાટવાળા

ઉપરોક્ત રીમાઈન્ડર ખીડી મોકલ્યા બાદ પણ કેટલાક અંકો સુધી રાહ જોઈ કિંતુ કાંધ પરિણામ ન આવવાથી એક ખંભાતી

નૈન ભાઈ અમદાવાદ જતા હતા તેમને વીરશાસનના તંત્રીને ઇથર મળ્ણ પૂર્વે બીડી મોકલેલ ખુલાસા પ્રસિદ્ધિને વિષે ખુલાસો મેળવો જણાવવા જણાવ્યું,

તે ભાઈએ તંત્રીની ઇથર મુલાકાત લીધી ત્યારે તંત્રી તરફથી એમ જણાવવામાં આવ્યું કે ‘અમે વિરદ્ધ પક્ષનું લખાણ અગટ કરતા નથી. અમે તો માત્ર એકજ પક્ષનું લખાણ અગટ કરીએ છીએ.’ જનાર ભાઈએ કહ્યું કે તો પછી તમે તમારા પત્રમાં એમ ખુલાસો કરો કે અમે એકજ પક્ષનું છાપીએ છીએ એટલે આ ખુલાસા નહિ છાપી રહ્યો છે.’ ત્યારે તેમ કરવાનો પણ ઈન્કાર કરવામાં આવ્યો. આ બધી વસ્તુસ્થિતિ વિચારતાં વિકેરી નૈન જનતાના અંતરમાં ખુલાસાર્થી રીમાધનડરમાં કરેલ નામ સુચના પ્રમાણે ‘પ્રશ્નોત્તર પ્રકાશ’ ભાગ ભીજ તરીકે આ પુર્સ્તક પ્રકાશનનું પ્રયોગન છે.

આ પુર્સ્તક પ્રકાશન માટે સુશ્રાવક ચોધરી ડેશરીચંદ્રજી પન્નાલાલજીની મારફતે નાગોર નગર નિવાસી ઓસવાળ સાહીય શુદ્ધ શ્રદ્ધાવાન સુશ્રાવક શ્રીયુત ચોધરી શુભકરણજીની યોગ્ય આર્થિક સહાય મળ્ણ છે. શ્રીયુત ચોધરીની માઝેક પુષ્પ નહિ તો પુષ્પપાંખડીના કથન અનુસાર અન્ય લભ્યાત્માએ પણ પોતાની શક્તિ પ્રમાણે આર્થિક સહાય આપતા રહી સાહિત્યની સેવા કરવા ઉલ્લેખ બને એમ છુંછીએ છીએ.

ઉં શાંતિ:

દ્વાખ.

એકપક્ષીય નીતિ.

(વિનયો વાચક વર્ગને જાણ થવી જરૂરી છે કે અમોએ ઉપરોક્ત મથાળાથી જહેર જનતા છેક અંધારામાં ન રહે તે આશયથી 'નૈનપત્રમાં' નીચે મુજબની વિગત છપાવા મોકલી હતી કે તેના તા. ૬-૧૦-૩૨ ના અંકમાં પ્રગટ થઈ હતી તે નીચે પ્રમાણે):—

જહેર જનતા છેક અંધારામાં રહી એકાંત મત બાંધી લે અને સત્ય વસ્તુસ્થિતિ પર પડ્હો પડે તે પહેલાં મારે હાર્દિક નભ્રતાપૂર્વક વિવેકી નૈનજનતાની જાણ ખાતર અનિચ્છાએ પણ આ વસ્તુ રજી કરવી પડે છે.

સુખલાલ ખુખ્યંદના નામથી તેમને શોલતી 'ભાષામાં મને કંઈક અર્શાર્થ'ભાવે રૂપ પ્રશ્નો વીરશાસનના તા. ૧૩-૫-૧૯૩૨ ના અંકમાં પૂછવામાં આવ્યા હતા. મને વિચારી જેતાં પ્રશ્નોના ખુલાસા આપવા આવશ્યક લાગવાથી અને કે પત્રમાં વ્યક્તિ પરત્વે પ્રશ્નો પૂછાય તે જ પત્રમાં તેના ઉત્તરો આવે તો તે પત્રના વાંચકવર્ગને માટે હીક વિચારી, મેં પૂછાયેલ પ્રશ્નોના ખુલાસા વીરશાસન પત્રના તંત્રી પર પ્રસિદ્ધ કરવા માટે રજીસ્ટર કાગળથી બીડી મોકલ્યા હતા, જેની પોસ્ટલ પહેંચ પણ મને યોગ્ય મુદ્દતમાં મળેલી.

પછી થોડા અંકો સુધી રાહ બોધ પણ તેને માટેનો ઉત્તર કે ખુલાસો પ્રગટ ન થવાથી મને રીમાધનંડર મોકલવાની ફરજ પડી અને તે પછી પણ થોડા અંકો સુધી રાહ બોધ પણ કંઈક પરિણામ ન આવવાથી, એક ખંભાતી નૈન ભાધ અમદાવાદ જતા હતા તેમને મેં વીરશાસન પત્રના તંત્રીને રૂખર મળી આ વસ્તુ પ્રસિદ્ધને વિષે ખુલાસો મેળવી મને જણાવવા જણાવ્યું.

તે ભાઈ તંત્રીને ભણ્યા ત્યારે તંત્રી તરફથી એમ જણાવવામાં આવ્યું કે ‘એમે તે ખુલાસા પ્રગટ નહિ કરી શકીએ કારણું એમે વિદ્ધ પક્ષનું લખાણુ પ્રગટ કરતા નથી. એમે તો માત્ર એક જ પક્ષનું લખાણુ પ્રગટ કરીએ છીએ.’ જનાર ભાઈએ કહ્યું કે ‘તે પછી તમે તમારા પત્રમાં એમ ખુલાસા કરો કે એમે એક પક્ષનું જ છાપીએ છીએ એટલે આ ખુલાસા નહિ છાપી શકીએ’ ત્યારે તેમ કરવાનો પણ ધન્કાર કરવામાં આવ્યો.

એટલે ઘણી જ દિલગીરી સાથે સ્પષ્ટ જણાવવું પડે છે કે કોઈ પણ સત્ય અને ન્યાયપ્રિય પત્રને માટે આવી એકાંત એકપક્ષીય નીતિ તેની ઉજ્જવળ કૃતિને કલંકરૂપ છે. ખાસ ખુલાસાની આશાએ વ્યક્તિ પરતે લાંબા મોટા હેડિંગથી લાંબા ચોડા પ્રશ્નો પુછાય અને ખુલાસા મળતાં પ્રગટ કરવાનો સમય આવે લારે તંત્રીને એકપક્ષીય નીતિના બળપર ઝુઝવું પડે ત્યારે તે પત્રની સત્ય, ન્યાય ને ધર્મપ્રિયતા ડેટલી હોય તે તો વાંચક જ વિચારી લે. અને ગૌરવભયો ‘વીરશાસન’ના નામાલિમાન નીચે આવી એકપક્ષીય બાજુ ખેલાય તે ધણું શોચનીય છે.

શાસનદેવ એ વીરશાસન પત્રના સંચાલકોને એની એકપક્ષીય અન્નેડ નીતિમાંથી બચાવી સત્ય માર્ગ વાળે એ જ અભ્યર્થિના.

આ સાથે નાન વિનંતી છે કે સાધુ-સાધ્યી, આવક-આવિકા જે કે કોઈને તે પ્રશ્નોના ખુલાસા જણાવાની જરૂરાસા હોય તેમણે તે પ્રશ્નોના ખુલાસા હુંક સમયમાં પુરિતકાકારે પ્રસિદ્ધ થનાર છે તેની નકલ નીચેને સીરનામેથી મેળવી લેવી.

નૈન ઉપાશ્રય
ખાળ પીપળા
અંભાત.

દ્ર. મુનિ સાગરચંદ્ર.



॥ શ્રીમત્રાગપુરીયવૃહત્તપાગચ્છાધિરાજયુગપ્રવરશ્રીપાર્થિચંદ્રસુરિસદ્ગુરુષ્યોનમઃ ॥

પ્રશ્નોત્તર પ્રકારી-

ખીજે ભાગ

લેખક:—

પરમપૂજય શ્રીભાતૃચંદ્રસુરિશિષ્ય મુનિસાગરચંદ્ર.

॥ અર્હમ् ॥

પ્રણમ્ય શ્રીમહાવીરં શાસનાધીશ્વરં પ્રભુમ् ।

સદ્ગુરું બન્ધુરાજેશં વાર્ણિં ચ શ્રુતદેવતામ् ॥ ૧ ॥

પ્રશ્નોત્તરપ્રકારોડ્યં ભવ્યાનાં હિતહેતવે ।

મુનિસાગરચંદ્રેણ શાસ્ત્રં વદ્ધવા વિધીયતે ॥ ૨ ॥

શ્રીખૈન પ્રવચન—લગ્નદ્વારાણી દ્વારાણાંગીને નમસ્કાર કરીને
સુખલાલ ઘૂંઘચંદ્રે પૂછેલ ખુલાસાના ઉત્તર.

નોંધઃ—ખુલાસા પૂછનારે તત્ત્વ જાણવાની લુણાસા
બુદ્ધિથી નહિ, પરંતુ આક્ષેપ કરવાની દૃષ્ટિએ પ્રશ્નો રજૂ
કર્યા છે. અમને તેનો જરાયે જેદ નથી; અમે તો મધ્યસ્થ
બુદ્ધિથી જે સત્ય લાગ્યું તે મુજબ તે ખુલાસાના નીચે પ્રમાણે
ઉત્તર આપીએ છીએ. અમારી માધ્યસ્થ વૃત્તિનો તોલતો
વાયક જ કરી લેશે. કાલિકાચાર્ય પછી યા તેમના સમ-

સમયમાં વિદ્યમાન એવા હેવદ્ધિગણિએ સંવત્સરી લાદરવા સુધ ૫ મી ને બદલે લાદરવા સુધ ૪ ની કરી હતી. તેવા લેખી પુરાવા સિવાય અન્ય કોઈ પ્રસ્તુતો માત્ર વિતાંડાવાદ અર્થે જ છે. એમ સમજતા હોવાથી આ ચર્ચા અમે અહિથી ખંધ કરીએ છીએ.

પ્રશ્ન ૧:—નિશીથ ચૂર્ણિકાર કાલકાર્ય પછી ઘણી સુદૃતે થયા એમ તમે માનો છો કે તેમના સમકાલમાં કિંવા તુરતમાં થયા માનો છો ?

ઉત્તર:—આનો ઉત્તર અમે લખેલ પ્રક્ષોત્તર પ્રકાશમાં આપેલ છે કે ‘કાલિકાર્ય પછી કેટલાચે કાળ બાદ નિશીથ ચૂર્ણિકાર થયેલ છે ? તેમનો નિર્શ્વિત સમય તે લખતી વખતે જાણવામાં નહોતો. હુલમાં ઉપરોક્ત કુથનની સત્યતા પૂરવાર કરતાં નીચેના એ ઉદ્દેશ મજ્યા છે. જેમાંનો પહેલો નિશીથ ચૂર્ણિના પ્રાંતે અને ભીજો નંદિસૂત્ર ચૂર્ણિના પૃષ્ઠ ૫૦-૫૧ માં છે.

(૧) ગુરુદિણં ચ ગણિતં મહત્તરતં ચ તસ્સ તુદ્દેહિ ।
તેણ કષ સા ચુણ્ણી વિસેસનામા ણિસીહસ્સ ॥

નમો સુયદેવયાએ ભગવતીએ । જિણદાસગણિમહત્તરેણ રહાઓ ।
નમ: તીર્થકૃદભ્ય: ॥.....

(૨) સકરાજતો પંચસુ વર્ષશતેષુ નંદાધ્યયનચૂર્ણી સમાપ્ત
ઇતિ । પૃષ્ઠ ૫૦-૫૧.

જિનદાસગણિ મહત્તરે નિશીથ ચૂર્ણિ લખી છે અને તે ઉપરાંત નંદિસૂત્રની ચૂર્ણિ પણ તેમની જ છે. આ એ ઉપરાંત પણ તેમણે ચૂર્ણિએ લખી છે. નંદિસૂત્રની

ચૂર્ણિમાં તે લખાણુનો શક વીરાત (વીરાત ૪૭૦ વિક્રમ + વિ. સ. ૫૭ થી ઈ. સ. +૬. સ. થી ૭૮ શક+શક સંવત્ ૫૦૦)=૧૧૦૫ માં લખાઈ એટલે નિશીથ ચૂર્ણિકારની વિવાહાનતા અગિયારમાં સૈકાના અંતમાં અને ખારમાની શરૂઆતમાં ગણી શકાય કાલિકાચાર્ય તો વીરાત ૪૫૩ યા ૬૬૩ માં થયા છે અને નિશીથ ચૂર્ણિકાર વીરાત ૧૧૦૫ એટલે કાલિકાચાર્યની પછીજ થયા એ તો દીવા જેવું સ્પષ્ટ છે જ.

પ્રશ્ન ૨:—નિશીથ ચૂર્ણિકાર અને તેમનો સકલ સમુદ્દરાય લાદરવા સુધી ૪ ના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરતો હતો કે નહિ ? જો તે સમુદ્દરાય તેજ સંવત્સરી કરતો હતો તો તે આખા સમુદ્દરાયને તમો આરાધક માનો છો કે વિરાધક ?

ઉત્તરઃ:—નિશીથ ચૂર્ણિકાર અને તેમનો સકલ સમુદ્દરાય લાદરવા સુધી ૪ ની સંવત્સરી કરતો હતો તેવું કોઈ લેખી પ્રમાણણ નથી. તેમ છતાં પણ પાંચમની સંવત્સરી કરતા હોવાનાં એ નિશીથચૂર્ણિનાજ પૂરવા છે. ચૂર્ણિમાં ‘હાત અપર્વ ચોથમાં પર્યુષણુ કેમ થાય છે?’ ઉત્થાનિકામાં ચૂર્ણિકાર જે પ્રશ્ન લ્યે છે તેનું કારણ એ છે કે આર્યકાલિકાચાર્યે કારણુવશ પોતાના સમુદ્દરાય સહિત ચોથની સંવત્સરી કરી તેમની હૈયાત પરંપરાના આચાર પર થતી ટીકાનું નિવારણ કરવા પુરતું છે. ચૂર્ણિકારના સમયમાં પણ ચોથ અને પાંચમ એ સાંવત્સરીક પરંપરા પ્રચલિત હોવાનું આથી માનવાને પૂરતું કારણ છે અને તેઓએ તે સમયના પ્રચલિતા

જ્રમનું નિવારણ કર્યું છે. તેમ ન હોત અને ચોથનીજ સંવત્સરી તેઓ કરતા હતા તેમજ હોત તો તેઓશ્રી શીર્ઘાજ પ્રક્ષ આ પ્રમાણે સુક્ત કે 'હાલમાં આપણે અપર્વ ચોથમાં પર્યુષણા કેમ કરીએ છીએ?' પરંતુ તેમની ઉત્થાનીકા એ પ્રકારની નથીજ નિર્ણિથ ચૂંણિનો સ્પષ્ટતમ ધ્વનિ એ છે કે ચૈમાસી પ્રતિકમણું પૂર્ણિમાએ જ કરવું: વિહાર એકમનો કરવો અને આ વરતુ સ્વીકારનાર તો આષાઢી પૂર્ણિમાથી ૫૦ દિવસે અને કાર્તિકી પૂર્ણિમાથી ૭૦ દિવસ પહેલાં અર્થાતું ભાદરવા સુધી પ મીની જ સંવત્સરી કરે. પરા પૂર્વથી ચાલ્યા આવતા પર્યુષણા પર્વમાં ફેરફાર તેમને સ્વીકૃત જ હોત તો તેઓ તે ચૂંણિમાં ચરિતાનુવાહે ઉપરોક્ત વર્ણન કરી પછી પરંપરાએ આ પ્રમાણે ફેરફાર થયો છે તે દર્શાવ્યા વિના રહેતજ નહિ. આ ઉપરાંત મુનિ કલ્યાણવિજયજી પોતાના 'વીર નિર્વાણ સંવત્ત ચ્યાર જૈનકાલગણના,' નામના પુસ્તકમાં કાલિકાચાર્યની તારીખ વીરાત ૪૫૩ જણાવે છે; જ્યારે બીજાએ તે વીરાત ૬૬૩ માં હતા એમ જણાવે છે. આ બંને વસ્તુનો સ્વીકાર કરીને આગળ ચાલીએ તો આપણુંને સ્પષ્ટ થશો કે ભાદરવા સુદ્ધ પ ની સંવત્સરી બદલીને ભાદરવા સુદ્ધ ૪ ની સંવત્સરી આર્ય કાલિકાચાર્યે કરી તે સર્વમાન્ય થઇ હતી કે કેમ?

સૌને એ તો વિદ્ધિ છે કે શ્રીમાન દેવદ્ધિગણિએ છેદ્વી આગમ વાચના વીરાત ૬૮૦-૬૬૩ માં વલ્લભીમાં કરી. આમ છે ત્યારે ને કાલિકાચાર્યની તારીખ ૪૫૩ હોય તો તે પછી

પર્ય-પ્રેર્ણ કલ્પસૂત્રની વાચના થઈ. ચોથની સંવત્સરીને પાંચસો વર્ષની પરંપરા થઈ ગયા પછી પણ દેવદ્વિગણિને સૂત્રમાં ભાદરવા સુદ્ધ પ મીની સંવત્સરી લખવી પડે અરી? ચારિતાનુવાહે પંચમી જણાવી તેઓ પરંપરાએ ભાદરવા સુદ્ધ ૪ ની સંવત્સરી કેમ ન જણાવે? હવે આપણે કાલિકા-ચાર્યની તારીખ વીરાત ૮૬૩ ની લઈએ તો પણ શ્રીમાન દેવદ્વિગણિ તેમના સમસમયી ગણાય એ તો વિવાદ વિનાની વાત છે. જે કાલિકાચાર્યે કારણુવશાત્ ભાદરવા સુદ્ધ ૪ ની સંવત્સરી કરી તો શ્રીમાન દેવદ્વિગણિએ તે સંવત્સરી ક્યારની કરી એ પ્રશ્ન ઉદ્ભાવે છેજ. ભગવતીજના એક પૂર્વની વિદ્યમાનતાના એક હંજર વર્ષના ઉદ્દેખથી એ તો સ્પષ્ટજ છે કે શ્રીમાન દેવદ્વિગણિ કે જેઓ એક પૂર્વના છેદા જાતા હતા. તેઓ વીરાત ૧૦૦૦ સુધી વિદ્યમાન તો હતા જ. એક પૂર્વની હૃદ્યાતીમાં સામાન્ય આચાર્ય-યુગ પ્રધાન આ સંવત્સરીનો ફેરફાર કરી શકે અરા? શ્રીમાન દેવદ્વિગણિને આ ફેરફાર સ્વીકાર્યજ હોય તો તેઓ વાચનામાં આ વસ્તુનો ઉમેરો કરવાને શું અશક્ત હતા? નહિજ. એટલે તેમને આ ફેરફાર જે કબુલ જ હોત તો તેઓ પોતાની કલ્પસૂત્રની વાચનામાં ચારિતાનુવાહે ભાદરવા સુદ્ધ પ મી ની સંવત્સરી જણાવી પરંપરાએ ભાદરવા સુદ્ધ ૪ ની સંવત્સરી કરવાનું વિધાન કરી તેની સ્થાપના મૂળ અંથમાંજ કરત.

પ્રશ્ન ૩:—તમે ૫૦ ૧૧ માં ‘કારણિઆ ચર્ચા અજ્જકાલગાયરિયેણ પવાત્તિઆ’ એ વાક્યનો અર્થ ૫૦ ૧૩ માં લખતાં તમે લખ્યું છે કે—‘કારણુથી આ ચોથ

આર્થ કાલિકાચાર્યે કરી ' તો પવત્તિઆ શહદનો અર્થ ' કરી ' એવો થાયકે ' પ્રવર્તાવી ' એવો થાય ?

ઉત્તરે:—પવત્તિઆ શહદનો મૂળ અર્થ ' પ્રવર્તાવી ' એ ખરાખર છે અને લાવ અર્થ ' કરી ' પણ થઈ શકે. ઉત્થાનિકામાં ચૂણ્ણિકારે આ શહદ વાપર્યો છે, પરંતુ મૂળહકીકિતમાં તે કયાંય પણ નથી; તેથીજ તે શહદ અમે સ્વીકાર્યો નથી. આચાર્યે ભાદરવા સુદ પ મીના ખદલે ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરી છે તે તો કારણુવશાત્ પ્રવર્તાનાર્થે નહિંજ.

પ્રશ્ન ૪:—લ૦ સ્થૂલલદ્રજુએ વેશ્યાને લ્યાં ચાતુર્મસ કર્યું, તો તેણે વેશ્યાના ઘરનું ચોમાસું પ્રવર્તાંયું એમ કહેવા તમે તત્પર છો ?

ઉત્તરે:—ના.

પ્રશ્ન ૫:—કોઈએ અપવાદપદે કાંઈપણ કાર્ય કર્યું હોય તેને અંગે પવત્તિઆ એવો જહદ કોઈપણ સ્થાને શાસ્ત્રોમાં જોયો છે ખરો ?

ઉત્તરે:—જેમ ચૂણ્ણિકારે ઉપરોક્ત ખાખતમાં વાપર્યો છે તેમ કાંઈપણ ઠેકાણે વપરાયો પણ હોય.

પ્રશ્ન ૬:—આચાર્યે ચોથ પ્રવર્તાવી એ વાતના પૂરાવામાં અથવા તો ચૂણ્ણિકાર મહારાજના સમયમાં કરાતી ચોથના ખુલાસામાં ' કાલકાચાર્યે કરી ' એ ખુલાસો વ્યાજથી ગણ્યાય ખરો ?

ઉત્તરે:—આચાર્યે ચોથ કરી તેનો તો ઉલ્લેખ ચૂણ્ણિકાર કરેજ છે. પરંતુ ચૂણ્ણિકાર મહારાજ ચોથ કરતા હતા

તેનો સીધો કે આડકતરો કંધ પણ પૂરાવોજ નથી, ઉલટું પંચમી કરતા હતા તેનો આડકતરો પૂરાવો પૂર્ણિમાની ચૌમાસી અને એકમનો વિહાર એ ઉલ્લેખ સ્પષ્ટ બતાવે છે. આ ઉપરાંત ચોથ સ્વીકાર્ય હોતતો શ્રીમાન દેવદ્વિગણિએ તે કદમ્બસૂત્રની વાચનામાં ચરિતાનુવાહે પંચમી જણાવી પરંપરાએ ચતુર્થી સ્વીકારી છે. એમ જણાવી તેમાં ઉમેરી તેની સ્થાપના તેઓ-શ્રીએ પણ કરી હત.

પ્રશ્ન ૭:—શ્રી કાલિકાચાર્ય પઢીના કોઈપણ આચાર્યે ભાદરવા સુદ્ધ પ મીની સંવત્સરી કરી તેનો એક પણ લેખ તમારી આખી ચોપડીમાં દર્શિગત થતો નથી, તો શું તેઓ અર્થાત કાલિકાચાર્ય પઢી કોઈપણ આચાર્યે પંચમી કર્યાનો લેખ શાસ્ત્રોમાં નથીજ એમ કેમ ન મનાય ?

ઉત્તર:—ભાદરવા સુદ્ધ પ મીની સંવત્સરી એતો ભગવાન મહાવીરની આજાજ છે એટલે તે પ્રચલિત હોયજ; તેથી તેનો ઉલ્લેખ વારંવાર કરવાની જરૂર નજ રહે. પરંતુ કાલિકાચાર્યે ભાદરવા સુદ્ધ પ મી બહદ્રી ભાદરવા સુદ્ધ ૪ ની સંવત્સરી કરી તે જે સર્વે આચાર્યાંએ અને તે સર્વેના સમુદ્ધાયે સ્વીકારી હોય તો તેના ઉલ્લેખની ખાસ જરૂર રહેજ. તેવો કોઈ ઉલ્લેખ છે ?

પ્રશ્ન ૮:—પર્યુષણા કદમ્બ ચૂર્ણિકાર અને દશાશ્વત સ્કંધ ચૂર્ણિકાર પણ ભાદરવા સુદ્ધ ૪ ની સંવત્સરી કરતા હતા એમ તમે માનો છો કે નહિ ?

ઉત્તર:—આ ચૂણીકાર યા ચૂણીકારો ભાદરવા સુદ્ધ ૪ ની સંવત્સરી કરતા હતા એવો ઉલ્લેખન નથી. ઉલ્લેખ અપવાદ કે ફેરફારનો હોય; મૂળ નિયમનો ઉલ્લેખ ન હોય. નિશીથ ચૂણીકારની માઝેક આ ચૂણીકારોએ પણ આર્યકાલિકાચાર્યની ભાદરવા સુદ્ધ ૪ ની સંવત્સરીનું કારણ બતાવવા તે વાત જણાવી છે. આ ઉપરાંત આ ચૂણીકારોને પણ પંચમી સ્વીકાર્ય હતી તેનો પૂરાવો પૂર્ણિમાના ચૌમાસી પ્રતિક્રમણ અને એકમના વિહારથી સ્પષ્ટ મળે છે.

પ્રશ્ન ૮:—તમારી આખી ચોપડીમાં ડોઈ પણ સ્થાને ખૂણે ખાંચરે પણ એવો એકે પાડ નથી કે જે પાડ એમ જણાવે કે ‘લ૦ કાલિકાચાર્ય પઢી કાલિકાચાર્યની પરંપરાવાળાજ ઇક્તા ચોથ કરતા હતા. પણ બાકીના ગચ્છો વાળાએ ચોથની સંવત્સરી નહોતા કરતા અને પંચમીની સંવત્સરી કરતા હતા; ?’

ઉત્તર:—મધ્યस્થ દૃષ્ટિવાળો વાચક તે તરતજ જાણી શકે; ૩૬ સંસ્કારી તે ન જાણી શકે.

પ્રશ્ન ૧૦:—કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય. આચાર્યશ્રી મલયગિરિજ વગેરે મહાપુરુષોને મૂલસૂત્રની વ્યાખ્યાને કરતાં જણાવેલી હકીકત જે આચરણાના પૂરવા તરીકે લેવામાં આવે તો તમે શું ‘અન્ય તીથી’ કે ગૃહસ્થેની આગળ કલ્પસૂત્ર વાચવામાં પ્રાયશ્ક્રિત છે’ એ અધિકારને તેજ પ્રમાણે કથન નહિ કરો અને તે પાડને તમે જૂઠી વ્યાખ્યાથી અલંકૃત કરશો એમ

માનવું ? ઉલડું તમે પર્યુષણુમાં ગૃહસ્થો આગળ
કદ્વસ્ત્ર વાંચો છો તેનું શું ?

ઉત્તર:—ઉપરોક્ત મહાપુરુષોએ મૂળસ્કુત્રની વ્યાખ્યા કરતાં
જણાવેલ હુકીકત આચરણાના પૂરાવા તરીકે લેવામાં
તમને બાધ લાગે છે. જન્યારે નિશીથ ચૂર્ણિકાર, પર્યુ-
ષણા કદ્વય ચૂર્ણિકાર અને દશાશ્વત સ્કંધ ચૂર્ણિકાર
વિગેરે મહાપુરુષોએ વ્યાખ્યા કરતા અપવાદ્દ્વપ સૂચિત
કરેલ વસ્તુને આચરણામાં મૂકવામાં તમને બાધ નથી
લાગતો ? ઉપરોક્ત પ્રશ્નોતો સર્વેને સમાન છે.

ગ્રંથ ૧૧:—આચાર્ય કાલિકાચાર્યે પ્રવર્તાવેલી જ ચોથની
સંવત્સરી સર્વ સાધુઓએ કરેલી છે. એ લાગ ચૂર્ણિના
મૂળ ભાગને લગતો હતો છતાં તમે તે શા માટે
છોડી દીધો છે ? તે વખતે કરેલ ચોથ સર્વ સાધુઓએ
જન્યારે માન્ય કરી ત્યારે તે બધા સાધુઓને શું કારણ
હતું ? શું તે બધા ચોથની પર્યુષણા કરનાર સાધુઓને
વિરાધક કહેવાને તમે હિંમત કરી શકો છો ?

ઉત્તર:—અમે ચૂર્ણિના અમૂક મૂળ ભાગને છોડી દીધો છે
એવો તમારો આક્ષેપ સાચો હોય અને તેમાં સર્વ
સાધુઓએ કરેલી છે' એ વસ્તુ હોય તો તે પાઠ
તમે શા માટે ખુલ્લો મૂકતા નથી ? પઈઠાણ પૂરમાં
કાલિકાચાર્યે કયા પ્રસંગોમાં અને કયા કારણે ભાદ-
રવા સુદ્ધ પ મીને બદલે ચોથની સંવત્સરી કરી તે
ણના તો પ્રશ્નોત્તર પ્રકાશમાં કહીજ છે.

ગ્રંથ ૧૨:—કાલિકાચાર્ય યુગપ્રધાન હતા તે વાત તમે માનો
છો કે નહિ ? અને જો માનતા હો તો યુગપ્રધાનની

આજા સકલ સંઘે માનવી એ કખુલ કરો છો કે નહિ ?

ઉત્તરઃ—પોત પોતાના સમુદ્દરમાં પૂજય આચાર્યવરને યુગપ્રધાન તરીકે આજે પણ માનનારા માને છે. અને સામાન્ય મુનિને જૈતમ ગણુધરથી પણ અધિક માનનારા પણ પડ્યા છે; તો તે વખતે તેમને તેમના અનુયાયીએ યુગપ્રધાન તરીકે માને અને તે યુગપ્રધાન હોય તેની કંઈ ના પણ નથી. પૂજય આચાર્યવરની આજા તેમના અનુયાયીએનો સંઘ માનતો આવ્યો છે અને માને છે; પરંતુ તેમને કંઈ આજાજ કરી નથી એટલે તેની વાત કયાં રહી ? આ ઉપરાંત નીચેની વાતો વિચારવા જેવી છે (૧) ચોમાસામાં યુગપ્રધાન રજા વિના દીક્ષા આપી શકે કે નહિ ? (૨) રજા યુગપ્રધાનને દેશનિકાલ કરી શકે કે નહિ ? (૩) તીર્થિકરની આજા અધિક કે યુગપ્રધાનની ? (૪) યુગપ્રધાન કથિત રજા કરે કે રજા કથિત યુગ પ્રધાન કરે ? (૫) મહાવીર શાસન વર્તી યુગપ્રધાન રજાના ધરના અજ્ઞપાન લઈ શકે કે નહિ ?

પ્રશ્ન ૧૩—૭૦ કાલિકાચાર્યની વખતે બીજા યુગપ્રધાનો હતા અને તેઓએ કાલિકાચાર્યની આજા નથી માની એમ જણાવવા માટે એક પણ શાસ્ત્રાધાર તમારી ચોપડીમાં આપવાની સલ્લ્યતા શું તમે બતાવી છે ? અને નથી બતાવી તો તેનું કારણ એજ કે તેવો એક પણ પૂર્ગાવો ન હોય અને તમે તે વખતના બીજા આચાર્યો

પાંચમની સંવત્સરી કરતા હતા એમ કહેવાને જે અહાર પડો, તે મુખાવાદ્ધથી વિરમણું કરનાર વૃતધારીને શોલે ખરું ?

ઉત્તરઃ—આ પ્રક્ષનો જવાણ પ્રક્ષ ૭ અને પ્રક્ષ ૨ ના ઉત્તરોમાં આવીજ જય છે.

પ્રેન ૧૪:—જે સકલ સાધુઓએ કાલિકાચાર્ય મહારાજના હુકમથી ચોથને દ્વિવસે સંવત્સરી કરી તો પછી તેના સમુદ્ધાયમાં પરંપરાએ પાંચમી રહી હતી એમ કહેવાને પૂરાવો કયો એ જણાવશો ? નિશીથ ચૂર્ણિકાર વગેરે મહાપુરુષો સુધી તમામ આર્યા નીચેજ થાય સંવત્સરી કરતા હતા એમ તમે શું માનતા નથી ?

ઉત્તરઃ—સકલ સાધુઓએ ચોથની સંવત્સરી કરીજ હોત તો શ્રીમાન દેવદ્વિ ગણિએ તે વાત કદ્વપસૂત્રની વીરાત ૬૬ઉની વાચનામાં મૂકી હત. કદાચ વાચના ખાદ કાલિકાચાર્ય ચોથની સંવત્સરી કરી એમ તમે કહેતા હો તો પણ શ્રીમાન દેવદ્વિગણિ જે વીરાત ૬૮૦-૧૦૦૦ સુધી વિધમાન હતા તેમને જે તે વાત સ્વીકારી હોત તો તે કદ્વપસૂત્રની વાચનામાં ઉમેરી લીધીજ હત. ઉપરના પ્રક્ષના ખીન લાગનો ઉત્તર પ્રક્ષ-૨ અને ૭ માંના ઉત્તરમાં આવી જય છે.

પ્રેન ૧૫:—ચૂર્ણિકાર ઇયાર્નિં કહં ચર્જિથણ અપવ્વે પજ્જો સવિજ્જતિ એટલે કે ‘હમણું અપવ્વ એવી ચોથમાં કેમ પર્યુષણુા કરાય છે ? એવો પ્રક્ષ ઉઠાવીને તે ચૂર્ણિકારની વખતે પણ સકલ સંધ ભાદરવા સુદ્ધ ૪

ની સંવત્સરી કરતો હતો એમ શું નક્કી કરતાં નથી ?
કેમકે તે પ્રશ્નમાં પોતાનો ગાંછ કે સંધાડો કે પોત
પોતાની જુદી જુદી પરંપરાનો ઉલ્લેખ દીધેલોજ નથી.

ઉત્તરઃ—તમે ચૂણ્યિકાર જે વીરાતું બારમાં સૈકામાં થયા છે
તંમને હ્યો છો તો તેની પહેલાનાં અર્થાતું કાલિકા-
ચાર્ય જે વીરાતું ૪૫૭માં થયા તે પછી વીરાતું ૮૮૦-
-૧૦૦૦માં વિધમાન દેવદ્વિગણિને શા માટે ઉડાવી
દો છો ? થીલું રીતે કહીએ તો કાલિકાચાર્યની સમ
સમયી દેવદ્વિગણિએ ચોથ સ્વીકાર્યાનું કંઈ પ્રમાણું
છે ? જ્યાં સુધી દેવદ્વિગણિએ ચોથ સ્વીકાર્યાનું પ્રમાણું
ન હોય ત્યાં સુધી ચોથ બધાય સાધુઓએ સ્વીકારી
એ વાત ગલતજ છે.

પ્રશ્ન ૧૬:—છઠના દિવસે પર્યુષણું નજ કરી શકાય તે
સકારણું છે કે નિષ્કારણું ? અને કારણ હોય તો તે
કર્યું ?

ઉત્તરઃ—છઠના દિવસે પર્યુષણું કરવાની આજાજ નથી,
તેથી તેમ ન કરી શકાય, સમવાયાંગ સૂત્રમાં ‘ભાઈ-
રવા સુદ પ મીની રાત્રી એળાંગવી કદ્પે નહિ’ એ
વિધાન છે. અને તેથી ‘યોગ્ય વસ્તી વિગેરે ન મળે
તો જંગલમાં આડ નીચે રહુને પણ સંવત્સરી કરે’
એમ જણુંયું પણ છે.

પ્રશ્ન ૧૭:—છઠની પર્યુષણું નહિ કરવાનું જે કારણ હોય
તેજ કારણ ચોથની પર્યુષણું કર્યાં પછી પાંચમની
પર્યુષણું ! કરનારને લાગે કે નહિ ?

ઉત્તર:—છઠની પર્યુષણું નહિ કરવાનું કારણું તો વીતરાગ દેવની આજા નથી માટેજ. પરંતુ પાંચમની પર્યુષણું તો તેમણે ફરમાવીજ છે, તેથી કારણે ચોથની સંવત્સરી કરનારને બીજે વરસે પાંચમની કરવામાં કંઈ વાંધો નથી, કારણુંકે તેજ તીથીની આજા છે માટે, અને આપણુંતો સંવત્સરી ઉપર દિવસે કરીએ છીએ એટલે એક દિવસનો ખાદ નજ આવી શકે, કેમકે તેથી ઉદ્દો દિવસ પૂરા તો થઈ જતાજ નથી.

પ્રશ્ને૮:—પાંચમની પર્યુષણું કરવાવાળો મનુષ્ય બીજે વર્ષે છઠની પર્યુષણું કરે અને ચોથની પર્યુષણુંવાળો બીજે વર્ષે પાંચમની પર્યુષણું કરે અને બન્ને જે આજા વિરાધક થતા હોય તો પાશ્ચચયંદ્ર સૂરિલુએ પોતાનો મત નહોતો કાઢ્યો ત્યાંસુધી તેઓ ચોથની સંવત્સરી કરતા હતા કે નહિ? એ કરતા હતા તો જ્યારે તેમને તે મૂકી પાંચમ કરી ત્યારે પાંચમ મૂકી છઠની કરનારાઓની માઝુક તેઓ પણ આજાના કહું વિરાધક ખરા કે નહિ?

ઉત્તર:—‘પાંચમની પર્યુષણું કરવાવાળો મનુષ્ય બીજે વર્ષે છઠની પર્યુષણું કરે તો તે પ્રલ્યક્ષ આજાવિરાધક છે,’ કારણું કે પ્રલ્ય આજા એવી છે. કારણે ચોથ કરનાર બીજે વર્ષે પાંચમ કરે તેમાં તો વીતરાગની આજા છે. પાશ્ચચયંદ્ર સૂરિલુએ પોતાનો મત કાઢ્યોજ નથી. પ્રલ્યએ જે આજા ફરમાવેલી હતી તેનો તેજ પ્રમાણે કડક અમલ કરતા કરાવતા તેમણે પોતાનો મત.

કાઢ્યો એમ તમે માનો છો ? પ્રથમ સિથિલાચાર ફૂર કરવા કિયા ઉદ્ધાર કર્યો તેથી તમે ભત કાઢ્યો માનો છો ? તો પછી શ્રીમાન જગતચંદ્ર સૂરિ અને આનંદ વિમલ સૂરિએ કિયા ઉદ્ધાર કર્યો તે શું ભત કાઢવા ? શ્રી સત્યવિજય પન્થાસે શ્વેત વસ્ત્રો છોડી પિત્ત વસ્ત્રો કર્યા તે શું ભત કાઢવા ? બુટેરાયજી મહારાજે વ્યાખ્યાન સમયે મુહુપત્તિ ન આંધવી એમ જલ્હેર કર્યું તે પણ શું ભત કાઢવા ? શ્રીમાન પાર્વત્યંદ્ર સૂરિજી પોતાનો ‘નાગપુરીય વૃહત્તપાગચ્છ ન છોડી તમારી માન્યતા અનુસાર ન ચાલ્યા, પરંતુ જિન આણું પ્રમાણે ચાલ્યા તેથી તેમને પોતાનો ભત કાઢ્યો એમ માનો છો ? શ્રીમાન પાર્વત્યંદ્રસૂરિજીએ કિયા ઉદ્ધાર કરતાં પહેલાં ચોથની સંવત્સરી કરી હતી તેનો તેવો લેખીત તે વખતનો પૂરાવો તમારી પાસે છે ખરો ? જેની પાસે પૂરાવો હોય તેતો ખહારજ પાડે; માત્ર ઓલીને લોકોને છેતરે નહિ. શ્રીમાન પાર્વત્યંદ્ર સૂરિજી સંવત્સરી ચોથની કરતા હતા તે બદલી પાંચમની નથી કરી; અને છતા કરી હોયતો તેમાં આજા વિરાધક પણું નથી તે ઉપરના પ્રશ્નના પ્રતિ-ઉત્તરથી સ્પષ્ટ છેજ. પરંતુ તમારા પ્રશ્નથી લાગે છે કે તમે એવા ફેરફાર કરનારને આજાના કંદા વિરાધક (ખરા કે નહિ ?) એમ કહો છો તો પછી તમે તે વિ. સંવત ૧૯૫૨

માં પેટલાદમાં ત્રીજની સંવત્સરી કરનાર અને વિ. સં. ૧૬૫૭ માં પાછી ૪ ની સંવત્સરી કરનાર મુનિ આનંદ સાગરને સાધુકે આચાર્ય તરીકે સન્માનો છો શું કરવા ? તેમાં તમને વિરાધના નથી હેખાતી ?

પ્રશ્ન ૧૯:—ભાદ્રવા સુદ ચોથે થયેલા તેવા અપરાધથી સૂત્ર, અર્થ, લોજન, વંદનાહિકના અનુકૂમે થયેલા પરિહારને છેલ્દેલા દિવસ જે ભાદ્રવા સુદ ત્રીજ થધ જાય તો ભાદ્રવા સુદ ૪ ના દિવસે તે બહિજીકારને પાત્ર થાય કે અદ્ધર એક દિવસ લટકતો રહે ?

ઉત્તર:—આ પ્રશ્નનો ઉત્તર તો મુનિ આનંદ સાગર આપી શકે કેમકે તેમણે ભાદ્રવા સુદ ઉ ની સંવત્સરી સં. ૧૬૫૮ માં પેટલાદમાં કરીને સં. ૧૬૫૭ માં ચોથની સંવત્સરી કરી તો તેઓ બહિજીકારને પાત્ર થયા કે એક દિવસ લટકતા રહ્યા ?

પ્રશ્ન ૨૦:—આચરણાઓને તમે માનો છો કે નહિ ?

ઉત્તર:—આગમ અવિરુદ્ધ આચરણાઓ માનવામાં કોઈ પ્રકારનો બાધ નથી.

પ્રશ્ન ૨૧:—શ્રીમાન કાલિકાચાર્ય ગીતાર્થ હૃતાં અને તેઓની કહેલી આચરણાઓ શુદ્ધ હતી તે માનો છો કે નહિ ?

ઉત્તર:—શ્રીમાન કાલિકાચાર્ય કોઈપણ નવી આચરણા ચલાવી નથી. તેમણે ન શુટકે ચોથ કરી પણ આચરણા ચલાવવા માટે નહી. આચરણા ચલાવવા માટે કરી હોત તો રાજના આગ્રહનું કારણ ચૂર્ણિકાર દર્શાવતજ નહિ.

પ્રશ્ન ૨૮:—આગમ અષ્ટોતરીનો ‘સંવચ્છર પવ પવતિહિ’ આપેલો પાડ તમે તેની ટીકા વગર કેમ આપ્યો છે ? શું તેની ટીકામાં સંવત્સરીપર્વની આચરણાને પ્રમાણુભૂત ગણુવાનો સ્પષ્ટ લેખ નથી ? તેવો સ્પષ્ટ ખુલાસો હોવા છતાં તે પાડને બહાર નહિ લાવનારને હુરાચહી ગણુવા કે નહિ ? શું તમારા લખવા પ્રમાણે સંવત્સરી પર્વ સિવાય બીજા પર્વમાં આચરણા કરાય તો તે તમને મંજૂર છે ?

ઉત્તરો:—ઉપરોક્ત પાઠની ટીકા પાસે ન હતી તેથી નહોંતી આપી. ટીકાકાર વ્યાખ્યા મૂલમાં હોય તેની કરે. તેથી ઉલ્લટી ટીકા કરે તો તે પ્રમાણિક નજ ગણુયા. મૂળ જે વિધિ પ્રતિપાદન કરે તો ટીકા તેનો નિષેધ કરે એમ કેમજ બને ? તમારા લખવા સુજખ સંવત્સરી પર્વની આચરણાને પ્રમાણુભૂત ગણુવાનો સ્પષ્ટ લેખજ હોય તો શા માટે તમે છપાવતાં નથી ? ઉપરોક્ત પદ્ધતનો બીજો લાગ આ ચર્ચામાં પ્રસ્તુત જ નથી કેમકે બીજા પર્વમાં પર્યુષણા કે સંવત્સરી કરવાનું અમે જણુંયું જ નથી.

પ્રશ્ન ૨૯:—સંવચ્છર પવ એ જુહુ લખવાનું કારણ શું ? શું સંવત્સરી પર્વમાં આવતી નથી ?

ઉત્તરો:—તો તો અંથકાર જાણો. એટલું તો સ્પષ્ટ છે કે અન્ય કંઈ પર્વો છે જ્યારે પર્યુષણા એ પર્વાધિરાજ છે.

ગ્રંથ ૨૪:—શ્રીમાન કાલિકાચાર્યે છઠને દિવસે પર્યુષણું કરવાની રાજની વિનતિ ન સ્વીકારી પણ ચતુર્થીની સ્વીકારી તો છે અને ચોથે પર્યુષણું કરવામાં ફરક હતો કે કેમ?

ઉત્તર:—ફરક તો હતો જ. કારણું કે સિદ્ધાંતમાં ‘પાંચમની રાત્રી ઓળંગવી નહિ’ એમ સ્પષ્ટ પાડ હોવાથી તેનો તો નિષેધ હતો જ. જ્યારે પંચમી પહેલાં સંવત્સરી ચા પર્યુષણું કરવામાં આધ ન હોવાથી રાજની તે વિનતિ સ્વીકારી. રાજની વિનતિ તે વખતે સકારણુંની હતી તેથી તેમણે તે સ્વીકારી. રાજ શું છે અથવા તો ચોથે સહા માટે ચલાવવા વિનતિ કરતો હતો? નહિંજ. પરંતુ તે વર્ષે દરમિયાન પોતે પર્યુષણું પર્વનો લાલ લઇ શકે તે તેનો હેતુ હતો. રાજની વિનતિથી કાલિકાચાર્ય પ્રભુની મૂળ આજા મૂકી હે એમ કહેવાય ખર્દું? નહિંજ. અથવા શું તેઓ પૈઠાણું નગરમાં નિરંતર ચ્યામાસ કરવા રહેવાના હતા કે જેથી હું મેશને માટે તેઓ ચોથનો સ્વીકાર કરે? નહિંજ. આમ હોય તો પછી નિરંતર ચોથનું કારણું ન રહેવાથી ચોથનો આથડું ટકી શકતો નથી.

ગ્રંથ ૨૫:—પહેલાં કરેલી સંવત્સરીની તીથીના ખાર-માસ થવાની અંદર એટલે કે ચોથે પર્યુષણું કરવી કહ્યો છે; તે વાત તમને પર્યુષણું કદ્યના આધારે માન્ય છે કે કેમ?

ઉત્તરઃ—તમે કહો છો તે પ્રકારે તો કંઈજ નથી. પર્યુષણું
 કદ્વયમાં તો આખાદી ચૈમાસી પ્રતિકમણું કર્યાં પછી
 પચાસમે દિવસે અને કારતક ચૈમાસીના સીતેર
 દિવસ પહેલાં એટલે કે લાદરવા સુદ્ધ પ મીની સંવત્સરી
 કરવા કરમાન છે; કારણું કે ચૈમાસી તો પૂર્ણિમાની
 કરવાનું તેમાં વિધાન છે. તમે લખો છો તે મુજબ
 પહેલાં કરેલ સંવત્સરીથી ભાર માસ થવાની અંદર
 પર્યુષણું કરવી તેમ હોય તો દર વર્ષે સંવત્સરી એક
 એક દિવસ આગળ આવતી જાય. અને તેમજ હોય
 તો આજે તે લાદરવા સુદ્ધ ૪ કે ૫ ની કાયમ જ ન
 રહી હોય. એ તો મુસલમાનોના મહોરમ માસની
 માઝેક અનિશ્ચિત બની જાય અને જે તેમ બને તો
 પછી ‘લાદરવા સુદ્ધ પ ની રાત્રી ઓળંગવી નહિ’
 એ મર્યાદા પ્રતિપાદક સૂત્રની સાર્થકતા પણ શી રહી !
 વળી જે તમે લખ્યું છે તેમજ હોય તો મુનિ આનંદ
 સાગરણે ગ્રીજની સંવત્સરી કરીને ત્યારખાદ ખીજે
 વર્ષે ચોથની સંવત્સરી કેમ કરત ? તમારા લખ્યા
 પ્રમાણે તો તે પણ પર્યુષણું કદ્વયના આધારે વિરાધ-
 કતા ખરીને ?

ગ્રન્થ ૨૬ઃ—કેદ્યપણું સૂત્ર પ્રમાણે પહેલાં વર્ષની સંવત્સરી
 તીથીથી આગલી તીથીમાં પર્યુષણું કરનાર જેવો વિ-
 રાધક ગણ્યાય તેવો તે તીથીની અંદરની તીથીમાં
 પર્યુષણું કરનાર વિરાધક ગણ્યાય ખરો ?

ઉત્તર:—આનો ઉત્તર પ્રક્ષે ૧૭ ના ઉત્તરમાં અને સુનિ
આનંદ—સાગરજીએ ત્રીજની સંવત્સરી કરીને ખીંડે
વર્ષે ચોથ કરી છે તો તે પણ તમારા હિસાબે વિરા-
ધક થયા કે નહિ ?

સૂચનાઃ:—જાહેર પત્રમાં છપાવીને ખુલાસા પૂછવાના અફલે
અમે પાસે હતા ત્યારે પાસે આવીને આટલા ખુલાસા
મેળવ્યા હત તો તે આપવા અમે તૈયાર હતા. છતાં
જાહેર પેપરમાં તમે ખુલાસા! પૂછયા છે તો તેના ઉત્તર
પણ અમે જાહેર પેપરમાં આપ્યા છે. તેમના જેવા
‘પ્રક્ષોત્તર પ્રકાશ’ની કિંતમ ન કરે તેની અમને
કર્શી ચિંતા નથી કારણું તેથી કાંઈ તેની કિંમત-
ઘટી જવાની નથી. તટસ્થ વાચક આ પ્રક્ષોત્તર પ્રકાશ
તથા ઉપરોક્ત ખુલાસાના ઉત્તરો વાંચી તેમાં રહેલ.
તથ્ય જરૂર મેળવી શકશે.

સ્વચ્છે દૃષ્ટિપાત્રમચ્છે શ્રીમનાગપુરીયકે ।

જૈનચાર્ય—યહર્ષીણાં વિશ્વચંદ્ર—મહાત્મનામ् ॥૧॥

શ્રીભ્રાતૃચંદ્રસ્થીન્દ્ર—સદ્ગુરુણાં પ્રસાદતઃ ।


સુનિસાગરચન્દ્રેણ ગ્રન્થોઽયં વિહિતો શુદ્ધા ॥૨॥

પ્રક્ષોત્તરપ્રકાશસ્ય ભાગે યદ્વિત્તયે મયા ।

વિરુદ્ધં લિખિતં તસ્ય મિથ્યાદુષ્કૃતમસ્તુ મે ॥૩॥

ઇતિ શ્રીજैનશ્વેતામ્બરાચાર્યપ્રવર—વિશ્વચંદ્રાનવદ્યવિદ્યા—
વિજારદ—વિદ્રુજ્જનમણલમાર્તણ—ગુર્જરનરેશ્વરશ્રીસિદ્ધરાજ જ-

यसिहसभाशृंगारहार-वादिदिगम्बरकुमुदचन्द्राचार्येभजयेशार्दूल-
सिंहलब्धप्रतिष्ठ-श्रीवादिदेवसूरिपुरन्दर-अविच्छिन्नपट्ट परंपरा-
नुगत-श्रीमन्नागपुरीयवृहत्तपागच्छाधिराज युगप्रधान-क्रियो-
द्धारकारक-श्रीजिनागममार्गप्रकाशक-परमपूज्यश्रीश्री श्रीपार्ष-
चन्द्रसूरीश्वरजी-संतानीय- सूर्खिक्रचक्रवर्ति-पूज्यपाद-जगत्-
श्रेष्ठिगुरु-प्रातःस्मरणीय- श्रीहर्षचन्द्रसूरिपुरंदर-चरणानुचर-
चारित्रचूडामणी संवेगरंगतरंगितात्मा शांतमूर्ति मुनिमहाराज
श्रीकुशलचंद्रजी सतीर्थ्य-गुरुभ्राता पंडितप्रवर-सुगृहीतनामधेय-
परमोपकारि-महर्षि-श्रीमुक्तिचन्द्रगणिना पादपद्मोपसेवी सुशि-
ष्य अने सद्धर्मरक्षक-जैनाचार्यप्रवर-श्रीहेमचन्द्रसूरीश्वरजीना
अद्वितीयपट्टप्रभावक-शासनप्रभाकर-सुविहितशिरोमणि सक-
लागमरहस्यवेदी-पंचप्रस्थानाराधक-पंचाचारप्रवर्तक-प्रशमरस-
पयोनिधि युगप्रवराचार्यवर्य-श्रीभ्रातुचन्द्रसूरीश्वरजी महाराजाना
शिष्य मुनिसागरचन्द्रे तत्वगवेषी जिनाज्ञाना पिपासु भव्यात्मा-
ओना हितना माटे आ प्रश्नोत्तरप्रकाश-ग्रंथनो द्वितीय भाग
खंभातनगरमां लख्यो, विक्रमसंवत् १९८८ ना वैशाख शुदी
त्रीज. करकृतमपराधं क्षन्तुमर्हन्ति धीराः ॥श्री शान्तिः ॥



તीર्थे वीरजिनेश्वरस्य विद्विते श्रीडाटिकाप्ये गणे,
 श्रीभव्यंद्रकुले वटोऽहृष्टहृष्टगच्छे परिभ्यायिते;
 श्रीभन्नागपुरीयकार्क्षयतपाप्राप्नावदातेधुना,
 स्फूर्ज्ज्ञान्तरिगुणान्विता गणुधरश्रेणिः सदा राज्ञते ॥१॥
 ये लोभे गुरुसाधुरत्नकृपया पारं श्रुतांभानिधे—
 ये नैनागमसंगतां सुखलितां चक्रे हितां देशनाम् ;
 यः स्वान्येपकृतेनिभितमकरैद रानक्षियास्वादरः,
 तं स्वरीश्वरमुतमं युग्मवरं श्रीपार्श्वचंद्रं स्तुमः ॥२॥
 श्रीभन्नागपुरीयकार्क्षयतपागच्छेशविद्यानिधि—
 द्वैर्थे स्वर्णगिरेःसमे हि लग्नान् सिद्धान्तरत्नाकरः;
 काऽङ्गादिगुणान्वितो गुरुवरः पूजये महान्योऽलव—,
 तं स्वरीश्वरमुतमं गणुधरं श्रीभातृचंद्रं स्तुवे ॥३॥

पाठित प्रवर श्री जिनचंद्रगणितुवर कृतः— संस्कृत श्री पार्श्वनाथ स्तवनम्

(राग प्रलाति सम रागेण गीयते)

(अथवा—‘ ज्य ज्य आरति आदि जिणुंदा ’ ए रागमां.)

अविचल लक्ष्मी विमल निवासं, वासवनिकरालिनतरै
 नतज्जनकल्पमहीरुहुकंदं, कंदं हवश्चलधारंरै. अविं १
 धारय चेतसि तं प्रभुपार्श्वं, पार्श्वं लवलतिकायारै;
 काया भाजितमेचकमलिनं, नलिनदलायतनयनंरै. अव० २
 नयनंहितनिजतीर्थमुदारं, दारधनोजितसंगंरै;
 संगं निर्वाहुकमतिधीरं, धीरं जित सुविद्गंधंरै. अव० ३
 दग्धकषायमनोलवभायं, भायित (कीर्ति) कीतिसनाथरै;
 नाथं तमहं कारं कारं, हन्मि विकारंरै. अव० ४

अरण्यमधिकसुखानां सततं, ततसहगुणुविस्तारं रे;
तारस्वरसुरवरगणुहारे, हारेहीरितहानं रे. ५० ५
दानविधानवशीकृतविश्वं, विश्वजनीनसुवाचं रे;
वाचं यमवर निर्मलमानस,—मानसहं स सुहेहं रे. ५० ६
(शार्दूलविडीडित—वृत्तम्)

देहश्रीलरनिर्मितैकज्ञनता नेत्रोत्सवे नायकः
कल्याणुभवर्ज्ञनैकज्ञलहो वामाश्वसेनांगजः
७० मांलोनिधिपारगः परमचिद्विद्धभीमनोवद्विलो
लव्यानां तनुतां सदा स लगवान् श्रीजैनयं द्विश्रियम्. ७

श्री पार्श्वनाथमंत्र गार्भित स्तवन

(देशी—चालती अने त्रुटकी)

सकल सदा कूल चिंतामणी समो,
नवरंग नारंग पास लविक नमो;
ओं नमो लावे पास ध्यावे नाथश्री श्रीलगवती,
धरणुंद्र पद्मभावतीय भाया भीज राया संज्ञुती;
अहुय भट्टे क्षुद्र विघट्टे क्षुद्रान्थलय थंलया,
वाजंती लूंगल हूरि भयगल यूरि अष्ट महालया. १
आशया पूरे पास पंथासरे,
श्रीवरकाणे पास संभेश्वरे;
संभेश्वरे श्रीपासथंलाणु जोडी मंडणु नाहेलो,
नवर्घंड श्रीकलिकुंड धणु जग जगतो जुराओलो;
जगतो तीरथ हुरे अनरथ पास समरथ तुं धणी,
हुवे चडा वहारेविधन लयहर सारकर तिहुआणु ताणी. २

કુરે કુરે વંચિત નવનિધિ સંપદા,
સ્વાહા પદ્મસ્યું ટાલે આપદા;
આપદા ટાલે રાજ્યપાલે પાસ ત્રિલુલન રાજુએ,
કલિકાલમાંહિ પાસ નામેં મંત્રમહિમા ગાળુએ;
દારિદ્ર ચૂરે આસ પૂરે પાસ તું જગદીશ એ,
ચરણુપ્રમોદતસુ શિષ્ય જ્ઞાપે પૂર્ધ સંઘ જગીસએ. ૩

શ્રી અજિતનાથ સ્તરવનમ્.

(રાખ સોરઠ)

તાર કરતાર સંસાર સાગરથકી,
લગતજન વિનવે રાતદિવસે;

અવર દ્વારાંતરે જાઈ બેલાં રહ્યાં,
તાહરો પીણુ લદો નહી દીસે.

તાર૦ ૧

આપણે કેડિ કરનોડિ જે ઓલગે,
દાસ અરદાસ તે કરણુ પાવે;

પણ ધણ્ણી જે હુવે જણ્ણુ સેવા તણ્ણો,
તો કિસું લગત પાસે કહાવે.

તાર૦ ૨

માહરો કથન મનમાંહિ જે આણુસ્યો,
પૂર્ણ્યો તા સહી એહ આસા;

કેડિ લાગા તિકે કેઠ કિમ મૂકુસ્યો,
નેટ કા એક કરિસ્યો દિલાસા.

તાર૦ ૩

સ્યું વલી તારવા કેન વા આવસ્યો,
અજિત જિન એતદો જે વિમાસે;

અકલ જિન રાજનો માજનો કુણુ લહે,
સહી તે તરે જે રહે પાસે.

તાર૦ ૪

મોટીખાખરવાળા શા રવળુ પ્રેમળુ પરમાર કૃત—

૧
વાર

શ્રીમાનુસહિતુરુને વંદના.

(દોહરા)

નામ લાવને વિનયથી, સહિતુરુ વંદન કાજ;
લખી પત્રિકા આજ છે, તમે સ્વીકારો રાજ. ૧
ગુરુ સાગર ગુરુ ચંદ્ર છે, ગુરુ રાજ ગુરુ ઈન્દ્ર;
ગુરુ મુજબન માલિક છે, શ્રીગુરુ સાગર ચંદ્ર. ૨

(રાગ-દેશ)

મહારું વંદન સુગુરુ સ્વિકારો સાગરચંદ્રલુરે

મહારું એ ટેક ૧

દેશ વિદેશો જયાં જયાં કરું છું, રઠણુ તમારું હૃદયે ધરું છું;
અંતરનાં આરામ સદા સુખ કંદળુરે. ૨
ભાગધ્રસ્યારી છો શૂરા, સહિતુરુ છો લરેલા પૂરા;
ધન્ય નગર જયાં વસો છો મુક્તિ નંદળુરે. ૩
જાની ધ્યાની પૂર્ણારામી, શાંન્ત દાંન્ત છો મહાંત નામી;
મહાન છો જેમ દેવ માંહિ છે ઈન્દ્રલુરે. ૪
વધુ કહું શું શ્રીગુરુ મારા, અખૂટ છે સહિતુરુ તમારા;
રવી નમે સહલાવે સાગર ચંદ્રલુરે. ૫
ઇતિ.



तैयार हो ! अलब्ध पुस्तकों
“सुरदीपिकादिप्रकरणसंग्रह” ३५
अन्थ की. ३. १)

“षड्व्यन्यस्वभावादिप्रकरणसंग्रह
महान् अन्थ की. ३. १)

“श्रीजैनराससंग्रहः” जेमां आड रासो हे. हुमणुज
भावार पडेल हो. तदन नवीन की. ३. १)

“सज्जायसंग्रहः” श्रीउत्तराध्ययन सूत्र आदिति सञ्जायो
हे. की. ३. ०॥)

“सुधर्मगच्छ परीक्षा” जेमां गच्छे संगीती प्राचीन
छतीहास हे. की. ३. ०)=

“शास्त्रीपंचप्रतिकमणसूत्र” जेमां नवस्मरण पर्यु हे.
की. ३. ०॥

“श्रीहुपाजिनेद्रस्तवनावलि” रागरागथीयुक्ता ६५
स्तवतो हे. की. ३. ०)=

“ગुजरातीपंचप्रतिकमणसूत्र” जेमां नव स्मरण
पर्यु हे. की. ३. ०॥

“गुजराती ये प्रतिकमणसूत्र” की. ३. ०)=

“प्रक्षोत्तरप्रकाश-प्रथमभाग” की. ३. ०)=

आ बधां पुस्तकोंतुं पोष्टेऽ अलग समजतुं,
तुरत मंगावो, साथे लेणना पुस्तकों भलयो.

शाहु मणीताल वाडीलाल.

कार्यवाहक-श्रीजैनहठीसींग सरस्वतीसखा.

शामगानी पोण-अमदावाद.